



વડોદરા મહાનગરપાલિકા
આરોગ્ય વિભાગ
www.vmc.gov.in

જાહેરનામું

The Disaster Management Act, 2005 ની કલમ-૩૦ તથા કલમ-૩૪ અને ગુજરાત એપીડેમિક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂએ હું, ડૉ. દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેરમાં નીચે મુજબ અમલ કરવા જાણ કરું છું કે,

- સંભવિત SUPER SPREADER તરીકે શાકભાજીનું વેચાણ કરતા ૨,૫૦૦ જેટલા ઈસમોએ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) ખાતે જઈ દિન-૦૩ (ત્રણ) માં PRO-ACTIVE SCREENING કરાવી લેવાનું રહેશે અને જરૂર જણાય તો SAMPLE લેવામાં મેડીકલ ઓફિસરશ્રીને સહકાર આપવાનો રહેશે. સ્ક્રીનીંગની કામગીરી બપોરે ૦૩=૦૦ થી સાંજે ૦૬=૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. સ્ક્રીનીંગ દરમિયાન શાકભાજી વેચાણ કરનાર હાઈ રીસ્ક ઈસમો જેઓ અન્ય બિમારી જેવી કે, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, કીડનીની બિમારી, શ્વાસની બીમારી ધરાવે છે તેમને Home Quarantine કરવામાં આવશે અને તેમની પરવાનગી રદ કરવામાં આવશે. આ માટે દરેક UPHC ખાતે દરેક વ્યક્તિનું કાર્ડ રાખવામાં આવશે અને તે વ્યક્તિએ દર ત્રણ દિવસે જે તે UPHC ખાતે અચુક હાજર રહી સ્ક્રીનીંગ કરાવી લેવાનું રહેશે જો વ્યક્તિ હાજર રહેવામાં નિષ્ફળ રહેશે તો તેને તેના વ્યવસાય માટે આપેલ પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.
- જેઓએ લોકડાઉન સમય દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર ચુનિટ્સ, દુકાનો કે મોલ્સ વિગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી, ફળફળાદિના વેચાણ અર્થે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલ છે અને જેઓને સરકારશ્રી દ્વારા મુક્તિ (છુટછાટ) આપવામાં આવેલ હોય તેવા તમામ વ્યક્તિઓએ પોતાનું સતત SELF SCREENING કરવાનું રહેશે અને તેઓને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વિગેરે પૈકી કોઈપણ લક્ષણ જણાય તો તૂર્ત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) અથવા VMC TOLL FREE NO. 1800 - 233 - 0265 ઉપર જાણ કરવાની રહેશે અને પોતે હોમ આઈસોલેશનમાં રહેશે. તે ના કરે તો Epidemic Act, 1897 અંતર્ગત એપીડેમિક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- અધિકૃત વેચાણ કરતા એકમો જેવા કે, દુકાનો અને મોલ્સના સંચાલકોને આથી ખાસ સુચિત કરવામાં આવે છે કે, તેઓએ તેઓને ત્યાં આવતા ગ્રાહકો પૈકી જે ગ્રાહકે MASK ન પહેર્યું હોય, SOCIAL DISTANCING ન જાળવ્યું હોય તેવા ગ્રાહકને કોઈપણ ચીજ-વસ્તુનું વેચાણ કરવું નહીં અને તે ગ્રાહકની વિગત TOLL FREE NO. 1800 - 233 - 0265 ઉપર જણાવવાની રહેશે.
- SOCIAL AUDITING ના ભાગરૂપે શહેરના નાગરિકોને જણાવવાનું કે કોઈ વ્યક્તિ જાહેર જગ્યાએ SOCIAL DISTANCING જાળવતું ન હોય અથવા MASK ન પહેર્યું હોય તેમ જણાય તો તે અંગે કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી શકશે અથવા તેનો ફોટો પાડી 99131-66666 ઉપર WhatsApp કરી શકશે. તે અંગેની ફરીયાદના નિવારણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડ કક્ષાએ Quick Response Team (QRT) બનાવવામાં આવશે.

ઉપર જણાવેલ વિગત બાબતે જે વ્યક્તિ નિષ્કાળજી દર્શાવશે તેમની સામે Section 188 of Indian Penal Code (45 of 1860) હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની દરેક નાગરિકે નોંધ લેવી.